

भारतीय जीवन बीमा निगम
LIFE INSURANCE CORPORATION OF
INDIA

प्रधान मंत्री जन धन योजना
के तहत जन-धन खाताधारकों
के लिये रु.30,000/- के
जीवन बीमा सुरक्षा के
दावा निपटारा हेतु प्रक्रिया - परिशिष्ट

PRADHAN MANTRI JAN DHAN
YOJANA
(PMJDY)

ADDENDUM - PROCEDURE FOR CLAIM
SETTLEMENT
UNDER LIFE INSURANCE COVER OF
Rs.30,000/- FOR PMJDY ACCOUNT HOLDER

પ્રધાનમંત્રી જન ધન યોજના (પીએમજેડીવાય) હેઠળ લાઇફ કવર - સંશોધનો

તારીખ 20.04.2015 સંદર્ભ: એફ.નં. 1-13016/01/2014-Ins.I પત્ર મુજબ, નાણાકીય સેવાઓનો વિભાગ, નાણાકીય ખાતું, ભારત સરકાર, પ્રધાનમંત્રી જન ધન યોજના (પીએમજેડીવાય) હેઠળ લાઇફ કવર અંતર્ગત ઠરાવેલ મૂળ નિયમો અને શરતોમાં મંજૂરીઓ/સંશોધનો અંગે, સંશોધિત નિયમો અને શરતો નીચે મુજબ છે:

1. પીએમજેડીવાયના દિશાનિર્દેશો અને સુવિધાઓ મુજબ, અયોગ્ય કેટેગરીઝ ફરાર હેઠળ એક અયોગ્ય કેટેગરી આ રીતે ઉલ્લેખિત છે, કે "અન્યથા પાત્ર ખાતા ધારકો, કે જેમની પાસે ખાતા સામે બેંકની અન્ય કોઈપણ યોજનાને લીધે લાઇફ કવર હોય, તેમણે બે યોજનાઓની વચ્ચે પસંદગી કરવી પડશે અને કોઈપણ એકમાંથી લાભ લઈ શકશે".

ફેરફારો :- તે નિર્ધારિત કરવામાં આવ્યું છે કે પીએમજેડીવાય યોજના હેઠળ સભ્યને કવરેજ નકારી શકાતું નથી; જો સભ્યએ તે જ બેંક ખાતા સાથે જોડાયેલ અન્ય વીમા લાભ મેળવવા માટે પોતે પૂર્ણપણે અથવા આંશિક રીતે વીમા પ્રીમિયમ ચૂકવ્યું છે.

2. પીએમજેડીવાયના સંયુક્ત ખાતાનાં કિસ્સામાં, જો પ્રાથમિક ખાતા ધારક રૂ. 30,000/- ના જોખમ કવર માટે અપાત્ર હોય તો પછી શું રૂ. 30,000/-નું જોખમ કવર ગૌણ ખાતા ધારક પર, જો તે/તેણી પાત્રતાની શરતોને સંતોષતા હોય તો, વિસ્તારીત કરી શકાશે?

ફેરફારો :- તે નિર્ધારિત કરવામાં આવ્યું છે કે પીએમજેડીવાય હેઠળના સંયુક્ત ખાતાનાં કિસ્સામાં, જો પ્રાથમિક ખાતા ધારક રૂ. 30,000/- ના જોખમ કવર માટે અપાત્ર હોય તો પછી રૂ. 30,000/-નું જોખમ કવર ગૌણ ખાતા ધારક પર વિસ્તારીત કરી શકાશે, સિવાય કે તે/તેણી લાઇફ કવર માટેની પાત્રતાની શરતોને સંતોષતા હોય.

3. યોજનાનું એક્સ્ટેન્શન : પહેલા યોજના 15.08.2014 થી 26.01.2015 ની અવધિ માટે ખોલવામાં આવી હતી

ફેરફારો :- હવે આ યોજનાને 31.01.2015 સુધી વધારવાનું નિર્ધારિત કરવામાં આવેલ છે.

4. તે શક્ય છે કે ખાતુ ખોલવાની તારીખે (ખાતાઓ 15મી ઓગસ્ટ, 2014 થી 25મી જાન્યુઆરી, 2015), ખાતા ધારક 18 વર્ષની ઉંમરનાં ન હોય પરંતુ તેઓ પછીથી 18 વર્ષની ઉંમરને પૂર્ણ કરતા હોય (16મી ઓગસ્ટ 2014 થી 26મી જાન્યુઆરી, 2015)". જો સભ્ય 26.01.2015 પહેલાં 18 વર્ષને ઉંમરે પહોંચતા હોય, તો પછી તેઓને પ્રધાનમંત્રી જન ધન યોજના (પીએમજેડીવાય) હેઠળ જીવન વીમા કવરેજ માટે ધ્યાનમાં લેવા જોઈએ કે નહીં.

ફેરફારો: - તે નિર્ધારિત કરવામાં આવ્યું છે કે જો કોઈ સગીર 15મી ઓગસ્ટ 2014 થી 26મી જાન્યુઆરી 2015 ની વચ્ચે ખાતુ ખોલાવે છે તો પછી તે 15.08.2014 થી 26.01.2015 (હવે 31.01.2015 સુધી વધારેલ) ની અવધિમાં 18 વર્ષ પૂરા કરે છે તો પીએમજેડીવાય હેઠળ તેઓ જીવન વીમા કવર માટે પાત્ર ગણવામાં આવવા જોઈએ.

5. પીએમજેડીવાય હેઠળ લાઇફ કવર માટેની મૂળભૂત પાત્રતાની શરતોમાં નીચે મુજબનાં સંશોધનોને મંજૂર કરવામાં આવ્યા છે :-

- i) મૂળ શરત:- પહેલીવાર બેંક ખાતુ ખોલાવનાર વ્યક્તિ, વધારામાં રૂપે કાર્ડ સાથે, 15.08.2014 થી 26.01.2015 સુધીની અવધિ દરમિયાન, અથવા અન્ય વધારાની અવધિ કે જે ભારત સરકાર દ્વારા આગળ વધારી શકાય છે.

સુધારેલી યોગ્યતા સ્થિતિ: - વધારામાં રૂપે કાર્ડ ધરાવનાર બેંક ખાતુ ખોલાવતી વ્યક્તિ, 15.08.2014 થી 26.01.2015 સુધીની અવધિ દરમિયાન, અથવા અન્ય વધારાની અવધિ કે જે ભારત સરકાર દ્વારા આગળ વધારી શકાય છે.

- ii) મૂળ શરત:- વ્યક્તિ સામાન્ય રીતે કુટુંબનો મુખિયા અથવા કુટુંબનો કમાઉ સભ્ય હોવો જોઈએ અને 18 થી 59 ની વય જૂથનો હોવો જોઈએ (એટલે કે વ્યક્તિ ઓછામાં ઓછો 18 વર્ષનો હોવો જોઈએ અને તેણે 60 વર્ષ ઓળંગેલ ન હોવા જોઈએ). જો કુટુંબનાં વડા 60 વર્ષ કે તેથી વધુ ઉંમરના હોય, તો ઉપર ઉલ્લેખિત વય જૂથમાંની, યોગ્યતાને પાત્ર કુટુંબની બીજી કમાઉ વ્યક્તિને કવર આપવામાં આવશે.

સુધારેલી યોગ્યતા સ્થિતિ:- વ્યક્તિ કુટુંબનો એક સભ્ય હોવો જોઈએ અને 18 થી 59 ના વયજૂથમાંથી હોવો જોઈએ (એટલે કે વ્યક્તિ ઓછામાં ઓછો 18 વર્ષનો હોવો જોઈએ અને તેણે 60 વર્ષ ઓળંગેલ ન હોવા જોઈએ) અને તે પાત્રતાની અન્ય તમામ શરતોને પૂરી કરતો હોવો જોઈએ જેમ કે એક બેંક ખાતું હોવું વગેરે.

- iii) મૂળ શરત:- વ્યક્તિ પાસે બેંક ખાતાથી લિંક કરેલું કોઈ રૂપે કાર્ડ અને બાયો-મેટ્રિક કાર્ડ હોવું આવશ્યક છે અથવા જો પહેલાથી તેવું ન હોય તો બેંક ખાતા સાથે લિંક કરવાની પ્રક્રિયામાં હોવું આવશ્યક છે.

સુધારેલી યોગ્યતા સ્થિતિ:- વ્યક્તિ પાસે બેંક ખાતાથી લિંક કરેલું કોઈ રૂપે કાર્ડ અને બાયો-મેટ્રિક કાર્ડ હોવું આવશ્યક છે અથવા જો પહેલાથી તેવું ન હોય તો બેંક ખાતા સાથે લિંક કરવાની પ્રક્રિયામાં હોવું આવશ્યક છે. જો કે, આ શરતને કારણે કોઈ દાવો નકારી શકાય નહીં.

- iv) મૂળ શરત:- કુટુંબનો કોઈ એક વ્યક્તિ બીમા યોજનામાં કવર કરવામાં આવશે અને જો વ્યક્તિ બહુવિધ કાર્ડ્સ/ખાતાઓ ધરાવતો હોય તો તે કિસ્સામાં લાભ ફક્ત કોઈ એક જ કાર્ડ હેઠળ મંજૂર કરવામાં આવશે એટલે કે કુટુંબ દીઠ ફક્ત એક વ્યક્તિ, પાત્રતાની શરતોને આધીન, રૂ. 30,000/- નું કવર મેળવશે.

સુધારેલી યોગ્યતા સ્થિતિ:- વ્યક્તિ બહુવિધ કાર્ડ્સ/ખાતાઓ ધરાવતો હોય તો તે કિસ્સામાં લાભ ફક્ત કોઈ એક જ કાર્ડ હેઠળ મંજૂર કરવામાં આવશે એટલે કે કુટુંબ દીઠ ફક્ત એક વ્યક્તિ, પાત્રતાની શરતોને આધીન, રૂ. 30,000/- નું કવર મેળવશે.

પીએમજેડીવાય હેઠળ અન્ય તમામ નિયમો અને શરતો તેમ જ દાવાઓના પતાવટ માટેની પદ્ધતિઓ મૂળ દાવા પદ્ધતિ અનુસાર અપરિવર્તનીય રહે છે.